

NE-116

November-2024

M.Com., Sem.-III**505 EA : Corporate Fin. Reporting
(New)****Time : 2:30 Hours]****[Max. Marks : 70**

1. નીચેના પ્રશ્નો પૈકી કોઈપણ બેનાં જવાબ લખો : 14
 - (i) નાણાકીય અહેવાલનાં મુખ્ય હેતુઓ જણાવો.
 - (ii) કોર્પોરેટ નાણાકીય અહેવાલને વ્યાખ્યાયિત કરો અને તેના ઉપયોગકર્તાઓ વિગતવાર જણાવો.
 - (iii) કોર્પોરેટ નાણાકીય અહેવાલનાં ગુણાત્મક લક્ષણો જણાવો.
 - (iv) કોર્પોરેટ નાણાકીય અહેવાલનું મહત્ત્વ જણાવો.
2. (A) ફરજિયાત પ્રગટીકરણ અને સ્વૈચ્છિક પ્રગટીકરણ વચ્ચેનો તફાવત 7
 (B) કોર્પોરેટ નાણાકીય અહેવાલની ઉપયોગિતા જણાવો. 7
 અથવા
2. કોર્પોરેટ નાણાકીય અહેવાલનાં ફરજિયાત (આદેશાત્મક) ઘટકો જણાવો. 14
3. વિગતવાર ચર્ચા કરો : ભારતીય હિસાબી ધોરણ-10; અહેવાલના સમયગાળા પછીના બનાવો. (ઘટના) 14
 અથવા
3. વિગતવાર ચર્ચા કરો : ભારતીય હિસાબી ધોરણ-16; મિલકત, ચંત્ર અને સાધન સરંજામ. 14
4. ભારતીય હિસાબી ધોરણ-33 : શેરદીઠ કમાણી જણાવો. 14
 અથવા
4. ભારતીય હિસાબી ધોરણ-38 : અદૃશ્ય મિલકતો જણાવો. 14
5. દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો : (કોઈપણ સાત) 14
 - (1) નીચેનામાંથી કયું નાણાકીય નિવેદનનું મૂળભૂત ઘટક (તત્ત્વ) છે ?
 - (a) મિલકતો અને જવાબદારીઓ (b) આવક અને ખર્ચા
 - (c) ઈક્વિટી (d) ઉપરનાં તમામ
 - (2) નીચેનામાંથી સારા નાણાકીય અહેવાલના આવશ્યક ગુણો કયા છે ?
 - (a) વિશ્વાસપાત્રતા (b) સંપૂર્ણ પ્રગટીકરણ
 - (c) વાસ્તવલક્ષી (d) ઉપરનાં તમામ

- (3) નાણાકીય અહેવાલના ખ્યાલના ભાગરૂપે નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?
 (a) કોર્પોરેટ (b) નાણાકીય
 (c) અહેવાલ (d) ઉપરનાં તમામ
- (4) નીચેનામાંથી કયું સંખ્યાત્મક પત્રક નથી ?
 (a) નફા-નુકસાન ખાતું (પત્રક) (b) નફા-નુકસાન ફાળવણી ખાતું
 (c) સંચાલક મંડળનું પત્રક (d) પાકું સરવૈયું
- (5) કોર્પોરેટ નાણાકીય અહેવાલ માટેની નિયંત્રણ કરતી સંસ્થા નીચેનામાંથી કઈ છે, જે મધ્યસ્થ સરકાર હેઠળ કામ કરે છે ?
 (a) ICAI (b) ICWA
 (c) SEBI (d) ઉપરનાં તમામ
- (6) નીચેનામાંથી કયા વિસ્તૃત સ્વરૂપો વર્ણનાત્મક પ્રગટીકરણ (Narrative Disclosure) ના ભાગરૂપે અને પૂરક પત્રકો તરીકે રજૂ કરવામાં આવે છે ?
 (a) હિસાબી નીતિઓ (b) હિસાબો પરની નોંધો
 (c) (a + b) ઉપરનાં બંને (d) ઉપરોક્ત કોઈપણ નહીં
- (7) નીચેનામાંથી કયું માહિતીનું નાણાકીય પત્રક નથી ?
 (a) ડિરેક્ટરનો અહેવાલ
 (b) હિસાબી નીતિમાં ફેરફાર
 (c) નાણાં ધિરાણમાં થયેલ ફેરફારોનું પત્રક
 (d) ચેરમેનનું નિવેદન
- (8) ભારતીય હિસાબી ધોરણ-1 દરેક પ્રકારની કંપની માટે ફરજિયાત છે સિવાય કે.....
 (a) ઉત્પાદન કરતી મોટી કંપની (b) બેન્કિંગ કંપનીઓ
 (c) ખનીજ કંપનીઓ (d) કુદરતી તેલ અને ગેસ કંપનીઓ
- (9) ભારતીય હિસાબી ધોરણ-10 માટે માત્ર _____ ની માન્યતા જરૂરી છે.
 (a) શેરહોલ્ડરો (b) સંચાલકો
 (c) લેણદારો (d) કંપની રજિસ્ટ્રાર
- (10) નીચેનામાંથી કયા સંબંધિત પક્ષકારો ગણાતા નથી ?
 (a) સપ્લાયર (b) ગ્રાહક
 (c) વિતરક (d) ઉપરનાં તમામ

NE-116

November-2024

M.Com., Sem.-III**505 EA : Corporate Fin. Reporting
(New)****Time : 2:30 Hours]****[Max. Marks : 70**

1. Write answer of any two questions from the following : 14
 - (i) Explain basic objectives of Financial Report.
 - (ii) Define Corporate Financial Report and explain its users in detail.
 - (iii) Explain the qualitative characteristics of Corporate Financial Report.
 - (iv) Explain importance of Corporate Financial Report.

2. (A) Difference between Mandatory disclosure and Voluntary disclosure 7
 (B) Explain the utility of Corporate Financial Report. 7

OR
2. Explain mandatory components of Corporate Financial Report. 14

3. Discuss the Events After the Reporting Period – Ind. AS-10 in detail. 14

OR
3. Discuss the Property, Plant and Equipment – Ind. AS-16 in detail. 14

4. Explain Earning Per Share : Ind. AS-33. 14

OR
4. Explain Intangible Assets : Ind. AS-38. 14

5. Select the correct alternative out of alternatives given for each question : (any seven) 14
 - (1) Which of the following is basic element of financial statement ?

(a) Assets and Liabilities	(b) Income and Expenditure
(c) Equity	(d) All of the above
 - (2) Which of the following are essential qualities of good financial report ?

(a) Faithfulness	(b) Full Disclosure
(c) Factual	(d) All of the above

- (3) Which are included as a part of concept of Financial Report ?
✓ (a) Corporate (b) Financial
(c) Report (d) All of the above
- (4) Which is not a quantitative statement ?
(a) Profit and Loss Account (statement)
(b) Profit and Loss Appropriation Account
✓ (c) Statement of BOD
(d) Balance Sheet
- (5) What is a regulatory body for corporate financial report worked under Central Government ?
✓ (a) ICAI (b) ICWA
(c) SEBI (d) All of the above
- (6) Which form a part of Narrative disclosure and as Supplementary statement of Broad heads ?
✓ (a) Accounting policies (b) Notes of accounts
(c) Both (a) and (b) (d) None of the above
- (7) What is not a financial statement of information ?
✗ (a) Director's Report (b) Change in accounting policy
(c) Statement of changes in finance (d) Chairman speech
- (8) Ind. AS-1 is mandatory for all types of companies except _____.
✓ (a) Big Manufacturing Companies (b) Banking Companies
(c) Mineral Companies (d) Natural Oil & Gas Companies
- (9) Ind. AS-10 requires approval of only _____.
✓ (a) Shareholders (b) Directors
(c) Creditors (d) Company Registrar
- (10) Who is not to be considered as related party from the following ?
✓ (a) Supplier (b) Customer
(c) Distributor (d) All of the above
-